

જો જન્મ સમયે છમાંથી એક નક્ષત્રમાં ચંદ્ર હોય, ત્યારે....

વ્યક્તિનો જન્મ જો અશ્વિની, આશ્લેષા, મધા, જ્યેષ્ઠા, મૂળ કે રેવતી આ છ નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે થયો હોય તો તેને મૂળ ગંડાંત કહે છે.

મૂળ ગંડાંત વ્યક્તિ, તેના પિતા, માતા, ભ્રાતા, ધન, સુખ તથા સ્વયં માટે ઘાતક ગણાય છે. જો ઉપર સૂચિત ઘાતક ઘટના ન બને તો તેવી વ્યક્તિને ધન, ઐશ્વર્ય, વાહન તથા જાગીરનો માલિક બનાવી, અને પુષ્કળ સુખ આપે છે.

Nakshatra	1-ચરણ	2-ચરણ	3-ચરણ	4-ચરણ
અશ્વિની	પિતાને ભય	સુખ-ઐશ્વર્ય માટે ભય	મંત્રીપદ માટે ભય	રાજ-સન્માન માટે ભય
આશ્લેષા	શુભ માટે ભય	ધનનાશ	માતૃનાશ	પિતૃનાશ
મધા	માતાને ભય	પિતાને ભય	સુખ માટે ભય	ધન-વિદ્યા માટે ભય
જ્યેષ્ઠા	મોટા ભાઈને ભય	નાના ભાઈને ભય	માતૃનાશ	સ્વયંનું મૃત્યુ
મૂળ	પિતૃનાશ	માતૃનાશ	ધનનાશ	સુખ માટે ભય
રેવતી	રાજ્યદ્વારે સુખ ભય	મંત્રીપદ પ્રાપ્તિ ભય	ધનસુખ પ્રાપ્તિ ભય	કષ્ટદાયી જીવન ભય

મૂળ ગંડાંતની શાંતિ : જન્મથી ૧૨મા દિવસે કે ફરી ગોચરવશ મૂળ આવે ત્યારે મૂળમાં જ કે કોઈ સમયે રિક્તા તિથિ (૪, ૯, ૧૪), શનિ કે મંગળવાર ત્યજી ક્ષિપ્ર, મૃદુ, ચર કે ધ્રુવ નક્ષત્રમાં મૂળની શાંતિ કરાવવી જોઈએ.

બાળકના પિતાએ ગરમ ઘીના પાત્રમાં સર્વપ્રથમ બાળકનું પ્રતિબિંબ જોવું, ત્યારબાદ જ બાળકને સન્મુખે જોવું જોઈએ. શાંતિ માટે બીજી રીત એ છે કે જે જગ્યાએ બાળકનો જન્મ થયો હોય તે સ્થળની ફરતે દશકોષમાં આવેલા ૧૦૦ કૂવાના પાણી મેળવી તેનું જળપાન બાળકને કરાવવું જેથી મૂળ દોષની શાંતિ થાય છે.

એક નક્ષત્ર દોષ નિવારણ : પિતા-પુત્ર કે પુત્રી, માતા-પુત્ર કે પુત્રી, બે ભાઈઓ આ દ્વંદ્વોનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હોય તો બેમાંથી એકને મૃત્યુ તુલ્ય કષ્ટ થાય છે.

આ કષ્ટ નિવારણ અર્થે સુવાર્ણ દાન તથા શાંતિયજ્ઞા કરાવવા જેથી અરિષ્ટ નિવારણ થાય છે.